usiness

Magenta Lifecare SME IPO open for subscription from June 5, 2024

Ahmedabad, Gujarat based mattresses & pillows brand Magenta Lifecare Ltd is planning to raise Rs. 7 crore from its SME public issue. The company has received approval to launch its public issue on BSE SME Platform. The public issue open for subscription on June 5 and closes on June 7. The proceeds of the public issue will be utilised to fund company's expansion plans including meeting working capital requirements and general corporate purposes. Fedex Securities Pvt Ltd is the lead manager of the issue. is the lead manager

The initial public offering comprises of a fresh issue of 20 lakh equity shares of face value Rs. 10 each. Company has fixed price of Rs. 35 per equity share for the public issue (including a premium of Rs. 25 per equity share). Minimum lot size for the application is 4000 shares which translates in to investment of Rs. 4000 shares which translates in to investment of the 1.4 lakh per application. Retail investor quota for the IPO is kept at 50% of the net offer. For nine months ended December 2023, company has reported net profit of Rs. 24 lakh and revenue of Rs. 6.30 crore. As on December 2023, Net Worth of the company was reported at Rs. 6.34 crore, Reserves & Surplus at Rs. 1.47 crore, Asset base of Rs. 15.05 crore. Shares of the company will be listed on BSE SME platform.

Incorporated in 2015, Magenta Lifecare Limited manufactures mattresses and pillows. The company offers foam-based products under the brand "Magenta" in India. Company's product portfolio includes memory foam, latex-based, bonded mattresses, pocketed springs etc.

New Delhi, June 5 lowering of the current NS) India stands to account deficit (CAD) and

(IANS) India stands to

gain as oil prices have fall-

en by over 4\$ a barrel this

week to a four-month low

in the international market

following the OPEC+ car-

tel's plan to allow an in-

crease in production this

year while an increase in

the US crude stockpiles

has added to bearish sen-

oil futures for August edged lower to \$77.50, on

Wednesday, while July

crude oil futures on WTI

(West Texas Intermedi-

fallen below \$80 a barrel

for the first time since

This augurs well for the Indian economy as

the country imports around 85 per cent of its

crude requirement and any decline in oil prices

leads to a reduction in the

CHANGE OF NAME

This in turn leads to a

country's import bill.

Oil prices have now

ate) were at \$73.22.

February 7.

The benchmark Brent

timents.

India to benefit as global oil prices decline by over \$4 a barrel

a strengthening of the

strengthening the exter-

nal balance, a decline in

oil prices also leads to

lower prices of petrol, diesel and LPG in the do-

mestic market which eas-

es inflation in the country.

also helped to reduce the

country's oil import bill by

allowing the oil compa-nies to buy Russian crude

at discounted prices de-

spite Western pressures

in the wake of the Ukraine

war. The Narendra Modi

government has stood

firm in maintaining its ties

with Russia despite the

The Government has

rupee.Apart

Maruti Suzuki commences biogas plant at Manesar amid Rs 450 crore renewable energy push The pilot biogas plant will provide energy for the manufacturing processes of the company's Manesar

New Delhi, June 5 (IANS) Maruti Suzuki India on Wednesday said it has commenced a pilot Biogas plant at its Manesar facility in the fiscal year 2024-25, as it plans to invest nearly Rs 450 crore over the next three years towards renewable energy initiatives.

The initiative is in alignment with the Ministry of New and Renewable Energy's 'Waste to Energy' programme, the company

said in a statement. In FY 2023-24, Maruti Suzuki invested Rs 120.8 crore towards commissioning renewable energy initiatives like solar power and biogas. It has increased the investment approximately fourfold to Rs 450 crore.

The pilot plant is designed to produce 0.2 tonnes of biogas daily.

sanctions against Mos-

cow imposed by the USA

and Europe. Russia has

now emerged as the larg-

est supplier of crude oil to

India replacing Iraq and

Saudi Arabia which occu-

pied the top slot earlier.

India has in fact become

the largest purchaser of

Russia's seaborne oil

which accounted for close

to 38 per cent of India's

total oil imports in April.
According to an ICRA report, the price of oil imports in April.

16 4 per cont and 15 6 per

16.4 per cent and 15.6 per

cent lower than the corre-

sponding levels from the

Gulf countries in FY2023

and 11 months of

FY2024, respectively.

"As we ramp up our production capacity from around 2 million to 4 million by 2030-31, we are also accelerating our efforts to increase the share of sustainable and renewable energy sources across our operations, said Hisashi Takeuchi, Managing Director and

CEO, Maruti Suzuki India. This is in line with Suzuki's 'Environment Vision

CHANGE OF NAME

I have changed my old name from **MUTHALIYAR** to new name MUDALIAR KANDAVEL SAMBANDAM **Add.** 120/944, Gujarat Housing Board, Khokhra Ahmedabad-380008

I have changed my old name from **BHITORA DULARI** JITENDRAKUMAR to new name DULARI JITENDRAKUMAR **CHAUHAN**

Add. 18/1, Sanket App, Shahalam Roza Ahmedabad

CHANGE OF NAME

NARENDRAKUMAR SONI to new name ALPESH NARENDRABHAI SONI Add. C-302, Grand Riviera Paldi, Ahmedabad 888

from **PAREKH ÚMABEN** NAYI UMABEN **SURESHBHAI** Add. D 104, Shiva

> Gandhinagar P201

KINJAL KETAN **BRAHMBHATT**

Add. Sudarshan Flat, Sabarmati. Ahmedabad-380005 889

PUBLIC NOTICE ENVIRONMENTAL CLEARANCE

State Level Environment ImpactAssessmentAuthority, Gujarat hasaccorded Environmental Clearance for the Building and Construction Project "Banyan Court Offices" at Survey No. 988, 989, 990, 991, 992/1-2, 993, 994, 995/1-2 of Kasba Village, Alembic City East, Alembic Road, Taluka & District Vadodara - 390 003 by Alembic Ltd. (File No.: SEIAA/GUJ/ EC/8(a)/829/2024) dated 31.05.2024 under the provision of EIA Notification, 14th September, 2006.

Copy of Clearance Letter is available with the Gujarat Pollution Control Board and may also be seen at PARIVESH, https://cpc.parivesh.nic.in. (Authorized Signatory)

Date: 05/06/2024

I have changed my old name from **MAKWANA RAJESHKUMAR** POPATBHAI to new name **MAKWANA RAJESHBHAI POPATBHAI** Add, 34 Krushna Corner Society Ghodasar

Ahmedabad

PROVIDING TELECOM **FACILITIES**

Signal & Telecommunication Department: Tender No: DRM-SnT-ADI-Tele 07 of 2024-25; Name of Work: Providing telecom facilities at Gandhidham, Maliya Miyana, New Bhuj (NBVJ) and other locations of Ahmedabad division; Estimated Cost of Work: ₹ 6179746.54/- (Sixty One Lakhs Seventy-Nine Thousand, Seven Hundred Forty-Six rupees and Fifty-Four paise Only): Bid Security: ₹ 123600/- One Lakhs Twenty-Three Thousand and Six Hundred only: Tender Closing and Opening Tender: Not Later than 15:00 Hours of 01/07/2024 and Opening on date 01/07/2024 at 15:30 Hours; Website of E-Tendering: www.ireps.gov.in

Like us on: facebook.com/WesternRly 60

ELIMINATION OF LEVEL CROSSINGS AND DEVELOPMENT OF TELECOM FACILITIES

Inviting Tender No. – DRM-SnT-ADI-Tele 08 of 24-25; DRM/S and T acting for and on behalf of The President of India invites E-Tenders against Tender No DRM-SnT-ADI-Tele 08 of 24-25 closing date 01.07.2024, 15:00 Bidders will be able to submit their original / revised bids upto closing date and time only. Manua offers are not allowed against this tender and any such manual offer received shall be ignored; (1) Name of Work Elimination of level crossings and development of telecom facilities at Radhanpur, Samakhiyali and various locations of Ahmedabad division; (2) Estimated Cost of Work: \$\breve{\pi}\$ 66.96.574.42/- (Bs Sixty Six Lakh Ninety Six Thousand Five Hundred Seventy Four Rupees and Forty Two Paisa only); (3) Earnest Money Deposit: ₹1,33,900/-(Rs. One lakh thirty three thousand nine hundred only); (4) Date and time of closing: Not later than 15:00 hrs of 0.107.2024; (5) Date and time of opening of Tender: Opening on 01.07.2024 at 15:30 hrs; (6) Web site of

WESTERN RAILWAY - VADODARA DIVISION **ELECTRIC LOCO SHED VADODARA** Tender Notice No. EL/TRS/BRC/ 2024-25/3 Dtd. 03/06/2024 Tender No. ELTRSBRC2425FE3

Name of the work with its location refilling testing, painting, labeling and replacement of spare (if required) of various capacity CO2 Type fire extinguisher of ELS/BRCY for 3 Years (Electric Loco Shed, Vadodara, W ii) Approx. cost of Works ₹ 6.68.441/- iii) Bid Security to be Deposited: ₹13,400/- iv) Date & Time for submission of tender & opening of tender: Tender submission through Electronically up to 15:00 Hrs. on 28.06.2024 & open after at 15:30 Hrs. on 28.06.2024. v) Web site particulars, Notice board location where complete details of tender can be seen & address of the office from where the tender form can be purchased: https://www.ireps.gov.in Electric Loco Shed, Nava yard, Vadodara Senior Divisional Electrical Engineer (TRS), Electric Loco Shed, Navayard,

Vadodara - 390 002 Gujarat

Like us on: f facebook.com/WesternRly 61 Like us on: f facebook.com/WesternRly 067

DUTRON POLYMERS LIMITED

REGISTERED OFFICE: DUTRON HOUSE, NR. MITHAKHALI UNDERBRIDGE, NAVRANGPURA AHMEDABAD-380009.

CIN NO. L25209GJ1981PLC004786 WEBSITE: dutronindia.com Email Id: investor@dutronindia.com

E-Tendering: www.ireps.gov.in

Notice for AGM

Notice is given that the 43rd ANNUAL GENERAL MEETING of the members of DUTRON POLYMERS LIMITED will be held on Friday, 12th July, 2024 at 11.30 am through Video Conferencing ("VC")/Other Audio-Visual Means ("OAVM"), to transact the business as set forth in the notice

In compliance with the MCA Circulars and SEBI Circular dated May 12, 2020, Notice of the AGM along with the Annual Report 2023-24 is being sent only through electronic mode to those Members whose email addresses are registered with the Company/ Depositories. Members may note that the Notice and Annual Report 2023-24will also be available on the Company's website www.dutronindia.comand website of the Stock Exchanges, i.e., BSE Limited at www.bseindia.com

Members who have not updated their email address and bank account details with company are requested to update the same at the earliest. (a) Members holding shares in physical mode and who have not registered / updated their email address and bank account details can contact Registrar and Share Transfer Agent Link Intime India Private Limited (b) Members holding shares in dematerialized mode are requested to register / update their email addresses and bank account details with the relevant Depository Participant.

Further, subject to approval at AGM, the company may be required to deduct TDS on dividend, if any, payable to the members. Members who wish to submit their Form 15G/15H for non-deduction of TDS shall submit the same on or before 05 July 2024 before 5.00 pm through email at investor@dutronindia.com. Any communication on the tax determination/deduction received post 5.00 pm of 05 July 2024shall not be considered.

The Company is providing facility of remote e-voting to its Members in respect of the business to be transacted at the AGM/EGM. For this purpose, the Company has entered into an agreement with Central Depository Services (India) Limited (CDSL) for facilitating voting through electronic means, as the authorized e-Voting's agency. The facility of casting votes by a member using remote e-voting as well as the e-voting system on the date of the EGM/AGM will be provided by CDSL. The shareholders should log on to the e-voting website www.evotingindia.com. The details are provided in the notice. The E-voting shall start at 11.00 am on 09th July 2024 and closes on 5.00 pm on 11th July 2024.

The Company will also provide E-voting facility during AGM. Only those shareholders, who are present in the AGM through VC/OAVM facility and have not casted their vote on the Resolutions through remote e-Voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-Voting system available during the AGM. If any Votes are cast by the shareholders through the e-voting available during the AGM and if the same shareholders have not participated in the meeting through VC/OAVM facility, then the votes cast by such shareholders shall be considered invalid as the facility of e-voting during the meeting is available only to the shareholders attending the meeting.

In case of any query, please contact on investor@dutronindia.com or ahmedabad@linkintime.co.in

For, Dutron Polymers Limited

Roopa Shah Company Secretary

Date: 05.06.2024 Place: Ahmedabad

CHANGE OF NAME

have changed my old name

om SHAIKH SAMINABANU

IMTIYAZBHAI to new name SHAIKH SAMENABANU

IMTIYAZAHMED

Add. 12, Bage Momin Row

House, Sarkhej Road,

Ahmedabad-380055

CHANGE OF NAME

have changed my old name from **TEHSIN**

SALIMMAHAMMAD

CHAUHAN to new name

TEHSIN SALIMMD

CHAUHAN

Add. E 201 Best Residency

Sarkhei Road,

Ahmedabad-380055

CHANGE OF NAME

have changed my old name

from AAMIR HAMZA

TOFIKBHAI

MANDOSORWALA to new

name AMIR HAMZA TAUFIQ

MANDSOURWALA

Add. 833, Kharawala Dehla

Nr Jamalour

Ahmedabad-380001

CHANGE OF NAME

have changed my old name

rom AKSHAY RAMESHBHAI

DARJI to new name AKSHAY RAMESHBHAI DABHI

Add. 203/2436, Gota

Housing, Gota,

CHANGE OF NAME

have changed my old name

rom THAKKAR ANUPABEN

KANUBHAI to new name THAKKARANUPA

DARSHANBHAI

Add. 21 Shreeji Bunglows

Isanpur, Ahmedabad

Sr. e-Tender No. No.

883A

facility. The residual organ-

ic manure will be utilised

in horticulture effectively

making it a zero-discharge

CHANGE OF NAME

I have changed my old name from PATEL KALAVATIBEN

VISHRAMBHAI to new name

PATEL KALABEN

DHANSUKHBHAI

Add. B-303, Sanidhya

Residency, Dehgam, Gandhinagar-382305

CHANGE OF NAME

I have changed my old name

from **VELANI DHANJI**

KARAMSHI to new name

PATEL DHANSUKHBHAI KARAMSHIBHAI

Add. B-303, Sanidhya

Residency, Dehgam,

Gandhinagar-382305

CHANGE OF NAME

I have changed my old name

from MOTIBEN KESAV

ODEDARA to new name

MADHUBEN DEVSIBHAI

BHATI Add. C89 New Ritanagar

Co Op Society, Amaraiwadi,

Ahmedabad-380026

CHANGE OF NAME

I have changed my old name

from **PATHAN MÓ. JUNED**

MO. JUBER to new name

PATHAN MOHAMMADJUNED

MOHAMMADJUBER

Add. 854, Nadiyavas

Mirzapur,

Ahmedabad-380001

CHANGE OF NAME

I have changed my old name

MOHAMMADALI to new

name NISARAHEMAD

MOHMMADALI SHAIKH

Add. B/2 Aehatesham

Duplex, Alkamar Society,

Juhapura, Ahmedabad-55

WESTERN RAILWAY - AHMEDABAD DIVISION

VARIOUS ENGINEERING WORKS

other ancillary works under jurisdiction of Divisional Engineer (Works) Ahmedabad.

Construction of RCC Overhead 7,81,47,152.00

DRM-ADI-72-2024-25 mobile (Android Base) G.P.S. 98,93,202.60 1,97,900.00

pased surveillance tracking system for monitoring of inspection & patrolling activity

04 DRM-ADI-73-2024-25 Ahmedabad-Chandlodiya-7,93,25,303.92 5,46,600.00

Khodiyar-Mahesana: CTR (P) 60 Kg by PQRS 12.604 Km (Ahmedabad-Viramgam

& Ahmedabad-Khodiyar), TRR (P) 60 Kg 3.504 Km (Ahmedabad-Viramgam & Ahmedabad-Khodiyar) & TBR 17.20 Km (Geratpur-Ahmedabad), TRR of pt no 202/c in torrent siding in railway boundry with overhauling of LC No, 1/EPH, TRR(P) 60 Kg of Br no 21 & 22A of Chandlodiya-Khodiyar section and track work in connection with provision of parcel loading line by extending dead end of line No.1 and Modificatin in South reception and dispatch yard for facility of simultaneous movement (Sabarmati BG & Sabarmati Jn.) and other associate work under

DRM-ADI- Ahmedabad Division :- Gradient 2,34,27,758.72 2,67,100.00

nut for hook bot and M-25 nut for fish plate bolts under jurisdiction of Divisiona

Name of work

Providing, fixing and installation of

ocations and other ancillary works in the jurisdiction of Ahmedabad Division

E-tender notice No. 08 of 2024-2025 dated : 31-05-2024

70-2024-25 tanks at various locations and

02 DRM-ADI-71-2024-25 Automation Valves at various

rom SHAIKH NISARAHMAD

881

Cost (₹)

1.64.500.00

1,58,06,601.80 2,29,000.00

82,25,055.55

95,08,810.86

focus, he added. The anticipated output is about 1 lakh standard cubic meters of biogas in FY2024-25. It will offset approximately 190 tonnes of CO2 per annum, said the com-

2050' and the govern-ment's renewable energy

KANDAVEL SAMMANDANE

CHANGE OF NAME

887

I have changed my old name from **ALPESHKUMAR**

CHANGE OF NAME

have changed my old name **GOVINDLAL** to new name

Blessing-1 Near Swagat Flamingo, Sargasan

CHANGE OF NAME

I have changed my old name from KINJAL KETANKUMAR **BRAHMBHATT** to new name

WESTERN RAILWAY - AHMEDABAD DIVISI

SIGNALING WORK

DRM/S and T acting for and behalf of Th President of India invites E-Tenders against Tender No DRM-SnT-ADI-Sig 16 (Re-invite) of 2023-24 closing date 24-06-2024, 15:00 Bidders will be able to submit their original/revised bids upto closing date and time only. Manual offers are not allowed against this tender, and any such manual offer received shall be ignored. Tender No. DRM-SnT-ADI-Sig 16 (Re-invite) of 2023-24 (1) Name of Work: Part supply of signalling material nstallation, testing & commissioning in connection with reliability improvemen by replacing overaged S&T gears of Ahmedad Division (Re-invite) (2) Estimated Cost of Work 2,59,31,769.68/- (Rs. Two Crore Fifty Nine Lakh Thirty One Thousands Seve Hundred Sixty Nine Rupees and Sixty Eight Paisa only) (3) Earnest Money Deposit: ₹ 2,79,700/- (Rs. Two Lakh Seventy Nine Thousands Sever Hundred only) (4) Date & Time of closing of tender and opening of tender: Not later than 15:00 hrs. of 24 06-2024 and Opening on 24-06-2024 at 15:30 hrs. (5) Website of E-Tendering: www.ireps.gov.in

Follow us on: <u></u> twitter.com/WesternRly

01stNovember 2024

Closing date and time of e-tender: Date 25-06-2024 at 15:00 Hrs. Office Address: Sr.Divisional Engineer (Co-ordination)-Ahmedabad, DRM Office, Nr. Chamunda Bridge, Opp. New Swadeshi Mill, Naroda Road, Amdupura, Ahmedabad-382334 Website for participating e-tender: www.irens.gov.in Like us on: facebook.com/WesternRly • Follow us on: twitter.com/WesternRly twitter.com/WesternRly

urisdiction of Sr. DEN (South) Ahmedabad.

sections using Lidar Survey technology.

Engineer (South) Ahmedabad.

Engineer (NW) - Ahmedabad

74-2024-25 verification of stations yards and

DRM-ADI- Infrastructure improvement to

75-2024-25 RUB in jurisdiction of Sr. Divisional

07 DRM-ADI-76-2024-25 Providing and fixing single piece spring inserted reusable M-27 lock

DUTRON POLYMERS LIMITED REGISTERED OFFICE: DUTRON HOUSE, NR. MITHAKHALI UNDERBRIDGE, NAVRANGPURA AHMEDABAD-380009.

CIN NO. L25209GJ1981PLC004786 WEBSITE: dutronindia.com Email Id: investor@dutronindia.com

NOTICE TO THE EQUITY SHAREHOLDERS OF THE COMPANY

Sub: Transfer of Ordinary Equity Shares of the Company to Investor Education and **Protection Fund Account**

We wish to draw your attention to Section 124(6) of the Companies Act, 2013 readwith the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016, as

amended (IEPF Rules). In terms of the provisions of Section 124(6) read with the Rules, all the shares in respect of which dividend is unpaid or unclaimed for 7 (seven) consecutiveyears or more, shall be transferred by the

Company to the Investor Education and Protection Fund (IEPF) constituted under Section 125 o In this regard, we hereby inform you that you have not claimed the Dividend amount for the FY 2015-16 as declared by the Company up to the expiry of 7 years and thus the same is due to be transferred to IEPF in Financial Year 2024-25 it self within expiry of 30 days from the due date i.e.

Further, pursuant to IEPF Rules, the Company is simultaneously liable to transfer those equity shares to IEPF in respect of which the dividend remained unclaimed by the shareholders for a period of seven (7) consecutive years by way of executing a Corporate Action as per the procedure

For Claiming the shares and dividend amount, please write to the Company at its Registered Address or email Investor@dutronindia.com or ahmedabad@linkintime.co.in on or before 01st November 2024 failing which the Company will have no other optionbut to transfer the shares held by you to IEPF.

Subsequent to such transfer of your equity shares to IEPF, all benefits which mayaccrue, if any in future, to such shares, including dividends, will be creditedto the IEPF.

In terms_of_Rule 7_of the_IEPF Rules, any person may claim his/her shares from IEPF authorities by filing an application in Form IEPF-5 and follow the prescribed procedure for re-transfer of such shares. The Rules and the application form (Form IEPF-5) as prescribed by the Ministry of Corporate Affairs for claiming back the shares and/or Dividend amount already transferred along with the procedure to be followed are available on the website of the IEPF, Ministry of Corporate Affairs at www.iepf.gov.in and company's website.

For further clarifications, please send an e-mail to Investor@dutronindia.com or ahmedabad@linkintime.co.in.

Assuring you of our best services at all times.

Thanking you,

Yours faithfully, For, Dutron Polymers Limited

Roopa Shah Company Secretary

Place: Ahmedabad

Place: Mumbai

Date: 05.06.2024

Business Brief |||

Coca-Cola India Celebrates World Environment Day with #BenchPeBaat

New Delhi, In celebration of World Environment Day, Coca-Cola India today launched #BenchPe-Baat, a campaign aimed at reviving the spirit of true connections and conversations among people. This is a celebration of Coca-Cola India's commitment to creating a World Without Waste through a circular economy and fostering meaningful interactions in communities across India.

Each benchis createdfrom approx. 50Kgs of recycled plastic waste. These eco-friendly benches have been installed in schools, colleges, public parks, and municipal corporation offices across 10 cities in India, including Delhi, Mumbai, Kolkata, Chennai, Bangalore, Hyderabad, Ahmedabad,

Pune, Dharamshala, and Lucknow. Speaking on the campaign, Rajesh Ayapilla, Senior Director-CSR and Sustainability for Coca-Cola India and Southwest Asia (INSWA), said, "At Coca-Cola India, we are steadfast in our commitment towards our global strategy called World Without Waste which drives systemic change through a circular economy of packaging. Our #BenchPeBaat campaign is a testament to our dedication towards sustainability, as we transform waste into meaningful community assets. These sustainable benches symbolize our efforts to reduce environmental im-

3 in 4 Indian B2B marketing leaders already using GenAl applications: Report

New Delhi, June 5 (IANS) Three in four Indian B2B (business-to-business) marketing leaders are already using generative artificial intelligence (GenAl) applications in their marketing activities, as it helped accelerate content creation (43 per cent), create cost efficiencies (39 per cent), improve productivity (38 per cent), a new report showed on Wednesday. According to the professional networking platform LinkedIn, there has been a 142 times increase in LinkedIn members globally adding Al literacy skills to their profiles, with marketers topping this list. Al is the fastest-growing digital skill for CMOs (Chief Marketing Officer) globally, based on the skills CMOs have added to their LinkedIn profiles in the past year. "A competitive B2B landscape and growing buyer influence has made it even more crucial for marketers to target bigger groups. That's why building collective confidence is essential and will help with brand recognition and sustained engagement," said Sachin Sharma, Director, Linkedln Marketing Solutions, India.

Garmin launches new range of smartwatches in India

New Delhi, June 5 (IANS) Garmin on Wednesday launched a new range of smartwatches under its Forerunner 165 series in India. Priced at Rs 33,490, the Forerunner 165 series comes in four colour options including Turquoise/Aqua, Black/Slate grey, Mist grey/ Whitestone, and Berry/Lilac. Consumers can purchase this smartwatch at select premium brand stores. "Garmin's Forerunner 165 Series has been specifically designed for professional runners and athletes who need to improve their performance every day, by closely analysing their training through monitoring pace, distance, wrist-based heart rate, VO2 max, and more," Dan Bartel, VP of Global Consumer Sales, Garmin, said in a statement.

HDB SERVICES **HDB FINANCIAL SERVICES LIMITED**

Tel. No.: +91 22 49116300, Fax No.: +91 22 49116666, Email: compliance@hdbfs.com,

NOTICE OF 17TH ANNUAL GENERAL MEETING AND E-VOTING INFORMATION

Notice is hereby given that: The 17th Annual General Meeting ("AGM") of the Members of HDB Financial Services

Limited ("Company") will be held through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") on Thursday, June 27, 2024 at 12:00 noon to transact the business, as set out in the Notice of 17th AGM. MCA General Circular Nos. 20/2020, 21/2021, 2/2022, 10/2022 and 9/2023 dated May 5, 2020, December 14, 2021, May 5, 2022, December 28, 2022 and September 25, 2023 respectively, ("MCA Circulars") have allowed the Companies to conduct their AGM through VC or OAVM, without the physical presence of the Members at a common venue, subject to the fulfilment of conditions as specified in the MCA Circulars. In compliance with the provisions of the Companies Act, 2013 and MCA Circulars, the AGM of the Company is being held

In compliance with the MCA Circulars, electronic copies of the Notice of the AGM and Annual Report for Financial Year 2023-24 have been sent to all the Members whose email address are registered with the Company/ Depository Participant(s). These documents are also available on the website of the Company at https://www.hdbfs com/investors under Investor Services and Financial Information respectively, on the website of BSE Limited at www.nbeindia.com and National Stock Exchange of India Limited at www.nbeindia.com and on the website of National Securities Depository Limited ("NSDL") at https://www.evoting.nsdl.com. The dispatch of Notice of AGM through emails has been completed on Wednesday, June 05, 2024.

Pursuant to Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, Members holding shares as on Thursday, June 20, 2024 (i.e. cut-off date) may cast their vote electronically on the ordinary and special business as set out in the Notice of the AGM through electronic voting system of NSDL.

The business as set forth in the Notice of the AGM may be transacted through remote e-voting or e-voting system during the AGM. . The remote e-voting shall commence from 09:00 a.m. on Monday, June 24, 2024

and ends at 05:00 p.m. on Wednesday, June 26, 2024. Remote e-voting module shall be disabled by NSDL after 05:00 p.m. on Wednesday

June 26, 2024. Once the vote on a resolution is cast by the Member, the Member shall not be allowed to change it subsequently. The cut-off date for determining the eligibility to vote by remote e-voting or by e-voting system during the AGM shall be Thursday, June 20, 2024. The facility for e-voting will also be made available during the AGM and those Members present in the AGM through VC facility, who have not casted their vote on

the resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be entitled to vote through e-voting system at AGM. The Members who have cast their vote by remote e-voting prior to the AGM may

also attend the AGM but shall not be entitled to cast their vote again The instructions for e-voting by electronic means are stated in the Notice of AGM to enable the Members to use e-voting facility.

Members who have not registered their email address are requested to register their email address with respective depository participants. The link for updating email address and mobile number electronically on a temporary basis is available on the website of Link Intime India Private Limited at: https://linkintime.co.in/emailreg/email_register.html

Any person, who acquires shares of the Company and becomes a Member of the Company after sending of the Notice and holding shares as of the cut-off date, may follow steps mentioned in the Notice of the AGM under "Access to NSDL e-Voting system". However, if a person is already registered with NSDL for remote e-voting then he/she can use his/her existing User ID and password for casting the vote.

In case of any queries relating to e-voting, you may refer to the FAQs for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of https://www.evoting.nsdl.com or call on toll free no.: 022 - 4886 7000 and 022 - 2499 7000 or send a request at evoting@nsdl.com or write an email to mt.helpdesk@linkintime.co.in or contact the undersigned.

Members who need assistance before or during the AGM, can contact Ms. Pallar Mhatre, Senior Manager - NSDL at evoting@nsdl.com or call on toll free no: 022 4886 7000 and 022 - 2499 7000. Mr. Mitesh Shah (FCS No.: 10070), Practicing Company Secretary, has been appointed

as the Scrutiniser to scrutinise the e-voting process in a fair and transparent manner. The result of the e-voting will be announced within three days after the conclusion of the AGM on the Company's website at https://www.hdbfs.com/investors and at the Registered Office of the Company. The record date for determining the names of Members eligible fo

as recommended by the Board of Directors, if approved at the AGM, will be paid on or after Friday, June 28, 2024 to the Members, after deducting TDS (Tax Deducted at Source), as applicable. In respect of the shares held in dematerialised mode, the dividend will be paid on the basis of beneficial ownership details to be received from NSDL and Central Depository Services (India) Limited for this purpose Members are requested to update their bank account details with their respective

equity shares, if approved at the AGM, is Thursday, June 20, 2024. The final dividend

Depository Participants with whom they are maintaining demat accounts on or before

As per the Income Tax Act, 1961, as amended by the Finance Act, 2020, dividends paid or distributed by the Company is taxable in the hands of the Shareholders and the Company is required to deduct TDS at the prescribed rates from the dividend to be paid to Shareholders. The detailed process of the same is provided in the AGM Notice, which is available on the website of the Company at https://www.hdbfs.com/investors.

For HDB Financial Services Limited

Dipti Khandelwa (Company Secretary) Membership No.: F11340 compliance@hdbfs.com +91 22 49116300

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે બે ગ્રીન બેલ્ટનું ઉદ્ઘાટન

(प्रतिनिधि)वापी, વિશ્વ પર્યાવરણ દિવસ – પ મી વિશ્વ પયોવરણ દિવસ – ૫ મી જૂન ૨૦૨૪ નિમિતે ગુજરાત સરકારના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના માનનીય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે VIA ની ગ્રીન સોસાયટી દ્વારા નિર્મિત બે ગ્રીન બેલ્ટ બનાવવાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાંથી એક આંબેડકર ચોકથી વિનંતી નાકા સુધીના લગભગ ૯૨૦૦ ચોરસ મીટરના વિસ્તારને હરિયાળો બનાવવા માટે દેગામ હરિયાળો બનાવવા માટે દેગામ રોડની બંને બાજુએ ગ્રીન બેલ્ટ વિકસાવવાની શરૂઆત કરવામાં આવી હતી. તે માટે કુલ ૧૩૦૦ મોટા વૃક્ષો અને ૧૧,૦૦૦ છોડ રોપવામાં આવશે. તેવી જ રીતે બેંક ઓફ બરોડાથી સેન્ટર ઓફ એક્સેલન્સ, વાપી સુધી આશરે ૨૯૦૦૦ ચોરસ મીટરમાં ગ્રીન બેલ્ટના વિકાસની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં ૪૦૦૦ મોટા વૃક્ષો અને ૨૦૦૦૦ છોડ રોપવામાં આવશે. ત્યારબાદ -માનનીય મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE), વાપી અને CETP, વાપી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

(प्रतिनिधि) सेलवास,

સંઘ પ્રદેશ સેલવાસ ખાતે

લાયન્સ ઇંગ્લિશ સ્કૂલ કેમ્પસમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉત્સાહભેર

ઉજવણી કરવામાં આવી હતી. આ

પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ સિલવાસા

યેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન સેલવાસ ફતેસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ અનંતરાવ નિક્રમ, જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્રસિંહ રાઠોડ, શ્રીમતી દેવકીબા

મોહનસિંહ જી ચૌહાણ કોલેજના

પ્રિન્સિપાલ સીમા પિલ્લઈ અને

ઈન્ચાર્જ વાઇસ પ્રિન્સિપાલ જાહ્નવી

આરેકર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

હવેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીગલ

EIA Notification, 14th September, 2006.

https://cpc.parivesh.nic.in.

દ્વારા કંપનીના એજીએમ યોજવામાં આવે છે.

Date: 05/06/2024

PUBLIC NOTICE

ENVIRONMENTAL CLEARANCE

State Level Environment ImpactAssessmentAuthority, Gujarat

hasaccorded Environmental Clearance for the Building and

Construction Project "Banyan Court Offices" at Survey No.

988, 989, 990, 991, 992/1-2, 993, 994, 995/1-2 of Kasba

Village, Alembic City East, Alembic Road, Taluka & District

Vadodara - 390 003 by Alembic Ltd. (File No.: SEIAA/GUJ/

EC/8(a)/829/2024) dated 31.05.2024 under the provision of

Copy of Clearance Letter is available with the Gujarat Pollution

Control Board and may also be seen at PARIVESH,

HDB FINANCIAL SERVICES

એચડીબી ફાઇનાન્સીયલ સર્વિસીસ લિમીટેડ (CIN U65993GJ2007PLC051028) રજી ઓકીસ : રાધીકા, બીજો માળ, લો ગાર્ડન રોડ, નવરંગપુરા, અમદાવાદ - ૩૮૦૦૦૯ કોર્પો. ઓફિસ : ગ્રાઉન્ડ ક્લોર, ઝેનીથ કારિસ કેશનગત માન્યો માર્ગ સ્થાન

ટાલ.ન.+૯૧ ૨૨ ૪૯૧૧૬૩૦૦, ફક્સ ન.+૯૧ ૨૨ ૪૯૧૧૬૬૬૬ ઇમેઇલ આઇડી : <u>compliance@hdbfs.com</u>, વેબસાઇટ : <u>www.hdbfs.com</u>

એચડીબી ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ ("કંપની") ના સભ્યોની ૧**૯મી વાર્ષિક સામાન્ય સભા**

("એજીએમ") શુક્રવારે વિડિઓકોન્ફરન્સિંગ ("વીસી") / અન્ય ઓડીયો વિઝયુઅલ મીન્સ ("OAVM") દ્વારા યોજાશે. ગુરૂવાર, ૨७ મી જૂન, ૨૦૨૪ ના રોજ બપોર્ટ ૧૨ વાગ્ચે આઈએસટી પર વ્યવહાર કરવા,

૧૫ મી એજીએમની સૂચનામાં જણાવેલ છે. એમસીએ જનરલ પરિપત્ર નં .૨૦/ ૨૦૨૦, ૨૧/૨૦૨૧ ૦૨/૨૦૨૨, ૧૦/૨૦૨૨, અને ૯/૨૦૨૩ તા.૫ મે, ૨૦૨૦, ૧૪ ડિસેમ્બર, ૨૦૨૧ અને ૫ મે

૨૦૨૨ અને ડિસેમ્બર ૨૮. ૨૦૨૨ અને સપ્ટેમ્બર ૨૫. ૨૦૨૩ દેશના અનેક સ્થળોએ વ્યક્તિઓની

રાઇક્ટર એના પ્રસાન ૧૮, ૧૦૧૬ એને ૧૬ નામ ૧૬, ૧૦૧૦ હતા છે. ૧૬ નામ અગાના આગાના અવજુવર પર સતત પ્રતિબંધને ધ્યાનમાં રાખીને, કંપનીઓને શરતોની પૂર્તિને આધિન, સામાન્ય સ્થળે સલ્યોની શારીરિક હાજરી વિના, વીસી / ઓએવીએમ દ્વારા તેમના એજીએમ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે.

એમસીએના પરિપત્રોમાં ઉલ્લેખિત છે. તેથી, એમસીએના પરિપત્રોનું પાલન કરીને, વીસી / ઓએવીએમ

. એમસીએના પરિપત્રોનું પાલન કરીને, એજીએમની સુચનાની ઈલેક્ટ્રોનિક નકલો અને નાણાકીય વર્ષ ૨૦૨૩ ૨૪ માટેના વાર્ષિક અહેવાલમાં, જે સભ્યોના ઈમેઇલ સરનામાં કંપની / ડિપોઝિટરી સહભાગી (ઓ) સાથે

ર કે મોદમાં પાયલે અલ્પાલમાં, જે ત્યાં ખેતા છે મેં ત્યાં કરવામાં કરમાં, કિપાની કહ્યાં (આ) સાથ - મીંધાયેલા છે, તેવા બધા સલ્પોને મોકલવામાં આવી છે. આ દસ્તાવેજો કંપનીની વેબસાઇટ https:// www.hdbfs.com/investors પર પણ ઉપલબ્ધ છે રોકાણકાર સેવાઓ અને નાણાકીય માહિતી હેઠળ અનુક્રમે, BSE લિમિટેડની વેબસાઇટ www.bseindia.com પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ www.nseindia.com પર અને નેશનલ સિક્ચોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (MSCI) માર્ગ નેશ્યાર્થિક માર્ગિક માર્ચિક માર્ચા હાલ્યા ત્યાર્થિક પ્રાથમિક માર્ચિક માર્ચા નેશિયા

("NSDL") ની વેબસાઇટપરઃ <u>https://www.evoting.nsdl.com.</u> ઈમેલ દ્વારા એજીએમની નોટિસ

કંપનીઓ અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૧૦૮ અને કંપનીઓ (મેનેજમેન્ટ અને એડમિનિસ્ટેશન) નિયમો રુ૧૧૪ ના નિયમ ૨૦ મુજબ ગુરુવાર, ૨૦ જૂન, ૨૦૨૪ (ક્ટ-એક્) પર શેર ધરાવતા સભ્યો ઈલેક્ટ્રોનિક રીતે પોતાનો મત આપી શકે છે. સામાન્ય અને વિશેષ વ્યવસાય જે એનએસડીએલની ઇલેક્ટ્રોનિક મતદાન

એજીએમની સૂચનામાં જણાવ્યા મુજબ એજીએમ દરમિયાન રિમોટ ઇ-વોટિંગ અથવા ઇ-વોટિંગ સિસ્ટમ દ્વારા થઈ શકે છે.

રિમોટ ઇ-મતદાન સોમવાર, ૨૪ જૂન, ૨૦૨૪ના રોજ સવારે ૦૯.૦૦ વાગ્યેથી શરૂ થશે અને ૨૬

ઇ-વોટિંગ મોડ્યુલ એનએસડીએલ દ્વારા બુધવાર, ૨૪ જૂન, ૨૦૨૪ના રોજ પ:૦૦ વાગ્યે બંધ કરવામ

આવશે. એકવાર સભ્ય દ્વારા ઠરાવ પર મત આપવામાં આવે, પછી સભ્યને તે બદલવાની મંજૂરી

એજીએમ દરમિયાન રિમોટ ઇ-વોટિંગ દ્વારા અથવા ઇ-વોટિંગ સિસ્ટમ દ્વારા મતદાન કરવાની યોગ્યત નક્કી કરવા માટેની કટ-ઓફ તારીખ ૨૦ જૂન, ૨૦૨૪, ગુરૂવાર રહેશે.

મતદાન માટેની સુવિધા એજીએમ દરમિયાન પણ ઉપલબ્ધ કરવામાં આવશે, અને વીસી સુવિધા દ્વારા

એજીએમમાં હાજર એવા સભ્યો. જેમણે રિમોટ ઇ-વોટિંગ દ્વારા ઠરાવો પર પોતાનો મત આપ્યો નથી અને

જે સભ્યોએ એજીએમ પહેલાં ઇ-વોટિંગ દ્વારા પોતાનો મત આપ્યો છે તે પણ એજીએમમાં હાજર થઇ

સભ્યોને ઇ-મતદાન સુવિધાનો ઉપયોગ કરી શકે તે માટે ઇલેક્ટ્રોનિક માધ્યમથી મતદાન કરવા માટેની

જે સભ્યોએ પોતાનું ઈમેઇલ સરનામું નોંધાવ્યુંનથી, તેમને સંબંધિત ડિપોઝિટરી સહભાગીઓ સાથે તેમનો ઇમેઇલ સરનામું નોંધાવવા વિનંતી છે. ઇમેઇલ સરનામું અને મોબાઇલ નંબરને ઇલેક્ટ્રોનિકલી

અસ્થાયી ધોરણે અપડેટ કરવા માટેની લિંક લિંક ઇનટાઇમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડની વેબસાઇટ પર

કોઈપણ વ્યક્તિ, જે કંપનીના શેર મેળવે છે અને નોટિસ મોકલ્યા પછી અને કટ-ઓફ તારીખે શેરો ધરાવીને કંપનીના સભ્ય બને છે, તે "એનએસડીએલ ઈ-વોટિંગની ઍક્સેસ" હેઠળ એજીએમની સૂચનામાં

ઉલ્લેખિત પગલાંને અનુસરી શકે છે. જો કે, જો કોઈ વ્યક્તિ પહેલાથી જ રિમોટ ઈ-વોટિંગ માટે NSDL

ક્ષાથે નોંધાયેલ હોય તો તે વોટ આપવા માટે તેના અસ્તિત્વમાંના યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયો^ર

ઇ-વોટિંગને લગતી કોઈપણ પ્રશ્નોના કિસ્સામાં, તમે શેરહોલ્ડરો માટેના પ્રશ્નો અને ઇ-વોટિંગ વપરાશકત

માર્ગદર્શિકાનો સંદર્ભ <u>https://www.evoting.nsdl.com</u> ના ડાઉનલોડ વિભાગ પર ઉપલબ્ધ શેરહોલ્ડરો માટે અથવા ટોલ ક્રી નંબર પર ક્રોલ કરી શકો છો. ૦૨૨-૪૮૮૬ ૭૦૦૦ અને ૦૨૨-૨૪૯૯

૭૦૦૦ અથવા evoting@nsdl.com પર વિનંતી મોકલો અથવા rnt.helpdesk@linkintime.co.in પર ઇમેઇલ કરી શકો છો અથવા pradeep.mokale@linkintime.co.in / અથવા નીચે સહી કરનારને પણ સંપર્ક કરી શકો છો.

. કે સભ્યોને એજીએમ પહેલાં અથવા તે દરમિયાન વીસી / ઓએવીએમ દ્વારા મીટિંગમાં ભાગ લેવા

અથવા ભાગ લેવા સહાયની જરૂર હોય, તેઓ એનએસડીએલને evoting@nsdl.com_o૨૨

શ્રી મિતેશ શાહ (FCS નંબરઃ ૧૦૦૭૦), પ્રેક્ટિસિંગ કંપની સેક્રેટરીની નિમણૂક કરવામાં આવી છે

ત્રા ભાષા કર્યા નિષ્પાંશ અને પારદર્શક રીતે ઈ-વોટિંગ પ્રક્રિયાની ચકાસણી કરવા માટે સ્કુટિનાઈઝર તરીકે. ઈ-વોટિંગનું પરિણામ પછીના ૪૮ (અડતાલીસ) કલાકમાં જાહેર કરવામાં આવશે. કંપનીની વેબસાઇટ

https://www.hdbfs.com/investors પર AGMનું નિષ્કર્ષ અને કંપનીની રજિસ્ટર્ડ ઓફિસમાં

જો એજીએમમાં ડિવીડન્ડ મંજૂર કરવામાં આવે તો ઇક્વિટી શેર પર ડિવિડન્ડ માટે પાત્ર સભ્યોના નામ નક્કી

જ અજ્યનમાં હાંગ્રંગ મહૂર કરવામાં આવા તો છટેટા દર વર્ષ દારંગ કરાય એક દિવેક્ટરાં ફારા બલામણ કરવાની રેકોર્ડ તારીખ ચૂરવાર, ૨૦ જૂન, ૨૦૨૪ છે. અંતિમ કિવિડન્ડ, બોર્ડ ઓફ દિવેક્ટરાં ફારા બલામણ મુજબ, જો એજએમમાં દિવીડન્ડ મંજૂર કરવામાં આવે તો, શુક્રવાર, ૨૮ જૂન, ૨૦૨૪ના રોજ અથવા પછી સભ્યોને, સ્રોત પર કર કપાત (ટીડીએસ) બાદ, લાગુ પડે તેમ ચૂક્રવામાં આવશે. કિમટીરિયલાઈઝ્ડ મોડમાં રાખવામાં આવેલા શેરના સંદર્ભમાં, આ હેતુ માટે એનએસડીએલ અને સેન્ટ્લ ડિપોઝિટરી સર્વિસીસ (ઇન્ડિયા) ત્રિમિટેડ ('સીડીએસએલ') પાસેથી મેળવવામાં આવનાર લાભકારી માલિકીની વિગતોના આધારે દિવેકન્ડ

આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ મુજબ, નાણાં અધિનિયમ, ૨૦૨૦ દ્વારા સુધારેલ મુજબ, કંપની દ્વારા

વિગતવાર પ્રક્રિયા એજીએમ નોટિસમાં આપવામાં આવી છે, જે કંપનીની વેબસાઇટ

યૂકવવામાં આવેલ અથવા વિતરિત કરવામાં આવેલ ડિવિડન્ડ શેરધારકોના હાથમાં કરપાત્ર છે અને કંપનીએ

ોત પર કર (ટીડીએસ) કાપવાની જરૂર છે. શેરધારકોને ચૂકવવાના ડિવિડન્ડમાંથી નિર્ધારિત દરો. તેની

ફોર, એચડીબી ફાઇનાન્સીયલ સર્વિસીસ લીમીટેડ

૪૮૮૬ ૭૦૦૦ અને ૦૨૨ - ૨૪૯૯ ૭૦૦૦ પર અથવા શ્રી પલ્લવી મહાત્રે મેનેજરનો સંપર્ક કરી શકે

ઉપલબ્ધ છેઃ https://linkintime.co.in/emailreg/emailregister.html

ન્યથા આમ કરવાથી પ્રતિબંધિત નથી, એજીએમ પર ઇ-વોટિંગ સિસ્ટમ દ્વારા મતદાન કરવાનો હકદાર

મોકલવાની પ્રક્રિયા બુધવાર, ૦૫ જૂન, ૨૦૨૪ના રોજ પૂર્ણ થઈ ગઈ છે

.... પ્રણાલી દ્વારા એજીએમની સૂચનામાં બહાર પાડવામાં આવ્યા છે.

જન. ૨૦૨૪ને બધવારે સાંજે ૦૫:૦૦ વાગ્યે સમાપ્ત થશે.

શકે છે પરંતુ તેઓ ફરીથી મતદાન કરવાનો હકદાર રહેશે નહીં.

સૂચના એજીએમની સૂચનામાં જણાવાયું છે.

કરી શકે છે.

અપડેટ કરે.

૧७મી વાર્ષિક સામાન્ય સભા અને ઈ-વોટિંગ માહિતી અંગે નોટિસ



એસોસિએશનની ગ્રીન સોસાયટી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ , નોટિફાઇડ એરિયા ઓથોરિટી -વાપી (NAA), વાપી ગ્રીન એન્વાયરો લિં. , ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) અને ઈન્ડસ્ટ્રીઝ સભ્યોના સહયોગથી નિયમિત પણે સામૂહિક વૃક્ષારોપણ, ગ્રીન બેલ્ટ ડેવલપમેન્ટ, બગીચાઓ અને વર્તુળોનો વિકાસ કરી વાપી ઔદ્યોગિક વસાહતમાં હરિયાળી જાળવવામાં મુખ્ય ભૂમિકા ભજવાઈ રહી છે. જેના કારણે સૌથી મોટા રાસાયણિક હબમાં પર્યાવરણીય સંતુલન જાળવવામાં મદદ મળી છે.વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના કાર્યક્રમોમાં VIA ના પ્રમુખ શ્રી સતીષભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી મગનભાઈ

સેલવાસ લાયન્સ ઇંગ્લિશ સ્કૂલ ખાતે

વિશ્વ પર્ચાવરણ દિવસની ઉજવણી

નિશા પરીખ, વાઇસ પ્રિન્સિપાલ

શિલ્પા તિવારી અને લાયન્સ ઇંગ્લિશ

(Authorized Signatory)

સ્ટડીઝ એન્ડ રિસર્ચના પ્રિન્સિપાલ સ્કૂલના પ્રિન્સિપાલ નિરાલી પરીખ,

સાવલિયા, માનદ મંત્રી શ્રી કલ્પેશભાઇ વોરા, ખજાનચી શ્રી રાજુલભાઈ શાહ, સહ માનદ મંત્રી શ્રી ચંદ્રેશભાઈ મારૂ તેમજ VIAના એડવાઈઝરી બોર્ડના મેમ્બર્સ એવા શ્રી એ કે શાહ, શ્રી યોગેશભાઈ કાબરિયા, શ્રી મિલનભાઈ દેસાઈ તથા શ્રી રજનીશ આનંદ, VIA ના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ અને GIDC ના RM શ્રી કુલદીપ સોલંકીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે VIA ના એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર્સ એવા શ્રી હેમાંગ નાઈક, શ્રી પ્રભાકર બોરોલે, શ્રી મિતેશ દેસાઈ, VGEL ના CEO શ્રી જતીનભાઈ મહેતા અને મોટા પ્રમાણમાં ઉદ્યોગોના સભ્યો તથા VIA અને VGEL ના સ્ટાફ સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

દિવસની ઉજવણી કરવામાં આવી વિશ્વ પર્ચાવરણ દિવસની ઉજવણી આપણી અમૂલ્ય

ઇકોસિસ્ટમને પુનઃસ્થાપિત કરવાની પ્રતિબદ્ધતાનું પ્રતિકઃ ડો. જે.એમ. વ્યાસ

ગાંધીનગર,

નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર દ્વારા તા.પમી જૂન, ૨૦૨૪ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. NFSUના કુલપતિ, પદ્મશ્રી ડૉ. જે.એમ. વ્યાસે

આ શુભ દિવસે વૃક્ષારોપણ કર્યું હતું. NFSUના કુલપતિ, પદ્મશ્રી ડો. જે.એમ. વ્યાસે આ પ્રસંગે જણાવ્યું કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવર્ણી આપણી અમૂલ્ય ઇકોસિસ્ટમને પુનઃસ્થાપિત કરવા અને તેનું રક્ષણ કરવાની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. વૃક્ષારોપણ દ્વારા આપણે ભવિષ્યની રૂતારા વડા કારા આવેલા આવેલાં પેઢીઓ માટે વધુ સુરક્ષિત ભાવિનું સંવર્ધન કરી રહ્યા છીએ. તેમણે સ્વચ્છતા માટે કટિબદ્ધ બનવા અને કાર્બન ફૂટપ્રિન્ટ્સ ઘટાડવામાં યોગદાન આપવા સૌને અનુરોધ

પ્રો.(ડૉ.) એસ.ઓ. જુનારે, ડાયરેક્ટર-NFSU, ગાંધીનગરએ જણાવ્યું હતું કે વિશ્વ પર્યાવરણ દિવસે, માનનીય કુલપતિશ્રી ડૉ. જે.એમ. વ્યાસે વૃક્ષારોપણ કર્યું હતું અને કેમ્પસમાં ર્ઇકો-ફ્રેન્ડલી વાતાવરણનું નિર્માણ



કરવા સૌને પ્રોત્સાહિત કર્યા હતા. विश्व पर्यावरश हिवस निभित्ते NFSUના દ્રજીજી યુનિટે પણ એક સમિટમાં પણ ભાગ લીધો હતો. તદુપરાંત, સ્કૂલ ઓફ લો, ફોરેન્સિક જસ્ટિસ એન્ડે પોલિસી સ્ટંડીઝ દ્વારા पश विश्व पर्यावरश हिवसनी ઉજવણી માટે એક વર્ચ્યૂઅલ

NFSU ખાતે વિશ્વ પર્યાવરણ

વૃક્ષારોપણ દરમિયાન પ્રો.(ડૉ.) એસ.ઓ. જુનારે, કેમ્પસ ડાયરેક્ટર-NFSU, ગાંધીનગર; પ્રો. (ડૉ.) નવીન કુમાર ચૌધરી, કેમ્પસે ડિરેક્ટર-NFSU ગોવા; ડૉ. ડી.ડી. ભગત, જોઈન્ટ રજીસ્ટ્રાર-NFSU અને વિદ્યાર્થીઓ પણ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું ઉપસ્થિત રહ્યા હતા.

પશ્ચિમ રેલવે – અમદાવાદ ડિવિઝન

સિગ્નલીંગ કામ

ીઆરએમ/એસ એન્ડ ટી ટેન્ડર નં. ડીઆરએમ-

એસએનટી-એડીઆઈ-સિગ 16 (પુનઃઆમંત્રિત<u>)</u>

2023-24 બંધ થવાની તારીખ 24-06-2024,

15:00, સામે ઈ-ટેન્ડરો આમંત્રિત કરે છે. બિડરો ફક્ત

સ્વીકારવામાં નહીં આવે, અને કોઈપણ મેન્યુઅલ ઓફર પ્રાપ્ત થશે તો તેને અવગણવામાં આવશે. **ટેન્ડર**

નં. ડીઆરએમ-એસએનટી-એડીઆઈ-સિગ 16

(પુનઃઆમંત્રિત) વર્ષ 2023-24 (1) કામનું નામઃ

મમદાવાદ ડિવિઝનના જૂના થઈ ગયેલા S&T ગિયર્સને

. લંબંઘમાં સિગ્લનીંગ સામગ્રીની આંશિક આપૂર્તિ,

સંસ્થાપન, પરિક્ષણ અને કમીશનીંગ કરવાનું કામ.

(પુનઃઆમંત્રિત) (2) કામની અંદાજીત પડતરઃ

₹ 2,59,31,769.68/- (રૂા. બે કરોડ ઓગણસાંઈઠ

ત્રાખ એકત્રીસ હજાર સાત સો ઓગણસિત્તેર અને

બડસઠ પૈસા પૂરા) **(3) અર્નેસ્ટ મની ડિપોઝીટઃ**

₹ 2,79,700/- (રૂપિયા બે લાખ ઓગણએંસી હજાર સાત સો પૂરા) **(4) ટેન્ડર બંધ થવાની અને ટેન્ડર**

ખલવાની તારીખ અને સમયઃ તા.24-06-2024 ના

. 15:00 કલાક સુધી તે પછી નહીં અને તા.24-06-

2024 ના 15:30 કલાકે ટેન્ડર ખોલાશે. **(5) ઈ-**

ટેન્ડરીંગની વેબસાઈટઃ <u>www.ireps.gov.in</u>

રાષ્ટ્રપતિ વતી અને તેમના માટે કાર્યરત

ગાંધીનગર મ્યુનિ. દ્વારા વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ ઉજવાચો

ગાંધીનગર, મ્યુનિ. આરોગ્ય શાખા દ્વારા અર્બન હેલ્થ સેન્ટર વિસ્તારના જુદા જુદા સ્થળોએ વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અર્બન સેન્ટરના મેડિકલ ઓફિસર, સ્ટાફ તેમજ આરબીએસકે ટીમ દ્વારા કિશોરીઓને માસિકની પ્રક્રિયા, માસિક ચક્ર, માસિક ચક્ર દરમિયાનની રાખવાની થતી કાળજી, સ્વચ્છતા તેમજ માસિક ધર્મ સાથે સંકળાયેલા ગેર માન્યતાઓ વિશે સમજળ આપવામાં આવી હતી. આ ઉપરાંત કિશોરીઓને કિશોરાવસ્થા દરમિયાનના થતાં ફેરફાર તેમજ કિશોરાવસ્થા દરમિયાન કેવો પોષણયુક્ત આહાર લેવો જોઈએ. તેના વિશે સમજણ આપવામાં આવી હતી.

Franklin Templeton Mutual Fund

પ્રત્યેક વ્યક્તિને તંદુરસ્ત આબોહવા અને સુરક્ષિત વાતાવરણમાં

જીવવાનોઅધિકારછે.આઅધિકારભાવિપેઢીનેઆપવામાટેપ્રચત્નશીલ

બની તારીખ ૫ જૂનના દિવસે આ૨.કે .દેસાઈ ગૂપ ઓફ કોલેજીસમા

વૃક્ષારોપણકાર્યક્રમેનુંઆયોજનકરવામાંઆવ્યુંહતું પ્રસ્તુતકાર્યક્રમમાં

ર્ચેરમેન શ્રી મિલન દેંસાઈ પ્રિ.ડો.પ્રીતિ ચૌહાણ, પ્રિ.ડો.મિત્તલ શાહ ,

પ્રિ.ડો .શીતલ ગાંઘીસરતથાપ્રાધ્યાપકોઅનેબી .એડ .જી .એસડેનિયલ

પટેલ તથા**LR**સોનાલી ટંડેલ અને દીક્ષિતા ટંડેલ તથા પર્ચાવ૨ણ મંત્રી

ઉપસ્થિત રહ્યા હતા આજના દિન વિશેષે કોલેજ કેમ્પસમાં ગુલાબ , તુલસી ,

મોગરાના છોડો તથા ૧૦૦ ચંપાના છોડ રોપવામાં આવ્યો હતા.

Cordially invites you for a program under it's Investor Education and Awareness Initiative.

> APMC Hall, New Market Yard, Patan - 384265 Date: 8th June, 2024

Time: 6:30 p.m. Contact Person: Pravin Sumesara (9898018526)

Due to limited seats, entry will be provided to registered attendees

only, Please call on the above number to register by tomorrow,

We look forward to your participation.



Registered office: One International Centre, Tower 2, 12th & 13th Floor, Senapati Bapat Marg, Elphinstone (West) Mumbai - 400013

> Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.

Franklin Templeton Mutual Fund

Cordially invites you for a program under it's Investor Education and Awareness Initiative.

Venue: Three Quarter Indian, 11th Floor, Vivan Square, B Wing, Jodhpur Cross Road, Suryapooja Block B, Satellite, Ahmedabad 380015

> Date: 8th June, 2024 Time: 6:00 p.m.

Contact Person: Abhishek Sharma (9601250290) Due to limited seats, entry will be provided to registered attendees only. Please call on the above number to register by tomorrow.

We look forward to your participation.

FRANKLIN TEMPLETON

Registered office: One International Centre, Tower 2, 12th & 13th Floor, Senapati Bapat Marg, Elphinstone (West) Mumbai - 400013

Mutual Fund investments are subject to market risks,

DUTRON POLYMERS LIMITED

REGISTERED OFFICE: DUTRON HOUSE, NR. MITHAKHALI UNDERBRIDGE, NAVRANGPURA

AHMEDABAD-380009.
CIN NO. L25209GJ1981PLC004786
WEBSITE: dutronindia.com Email Id: investor@dutronindia.com

કંપનીના શેરધારકો માટે સૂચના

કંપનીધારો ૨૦૧૩ની કલમ ૧૨૪(ε) તથા રોકાણકાર શિક્ષા અને સુરક્ષા નિધિ પ્રાધિકરણ (લેખા, સંપરીક્ષા અને પ્રતિદાય) નિયમ ૨૦૧૬ ની જોગવાઈ અનુસાર જે શેર ઉપર, જેતે ધારકને ચુકવાપાત્ર ડિવિડંડ સતત સાત વર્ષ સુધી જે તે ધારકે ન વટાવ્યુ હોય, તો તેવા બધાજ શેરને કંપનીધારા ૨૦૧૬ની કલમ ૧૨૫ હેઠળ સ્થાપવામાં આવેલા રોકાણકાર શિક્ષા અને સુરક્ષા નિધિમાં જમા કરવાના હોય છે.

આથી શેરધારકોને સુચના આપવામાં આવે છે કે જો આપે ૨૦૧૫-૧૬ નું ડિવિડંડ ન વટાવ્યું હોય તો કંપની દ્વારા તેને ૧ નવેમ્બર ૨૦૨૪થી ૩૦ દિવસની અંદર રોકાણકાર શિક્ષા અને સુરક્ષા નિધિમાં જમા કરી દેવામાં આવશે.

તથા નિયમ પ્રમાણેની પ્રક્રિયા અનુસાર કંપની એવા બધા જ શેરને પણ રોકાણકાર શિક્ષા અને સુરક્ષા નિધિમાં જમા કરાવવાની છે, તેની ઉપરનું ડિવિડંડ સાત વર્ષ સુધી વટાવવામાં ન આવ્યુ હોય.

આપનું બાકી ડિવિડંડ કે શેર ને રોકાણકાર શિક્ષા અને સુરક્ષા નિધિમાં જમાં થતાં અટકાવવા માટે આપ સત્વરે કંપનીના ઈમેલ Investor@dutronindia.com or ahmedabad@linkintime.co.in ઉપર ૧ નવેમ્બર ૨૦૨૪ પહેલા સંપર્ક કરો. જે આપ તેમ કરવામાં કસુર કરશો તો કંપની પાસે આપના બાકી ડિવિડંડના નાણાં અને શેર ઉપરોક્ત ભંડોળમાં જમા કરાવ્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ રહેશે નહીં.

ઉપરોક્ત ભંડોળમાં શેર જમા કરાવી દીધા બાદ જેતે શેરને લગતા જે કોઈ પણ લાભ છે, તે આ ભંડોળમાં જ જમા કરવામાં

જો આપ આપના શેર ઉપરોક્ત ભંડોળમાંથી પરત લેવાં માંગતા હોય તો આપ નમૂના IEPF-5 હેઠળ અરજી કરી શકો છો. આ અંગે કંપની બાબતોના મંત્રાલયે જે નિયમો બનાવેલા છે તે આપ www.iepf.gov.in ની વેબ સાઈટ, કંપની બાબતોના મંત્રાલયની વેબસાઈટ અથવા અમારી વેબસાઈટ ઉપર જોઈ શકો છો.

આ અંગે વધુ માહિતી મેળવવા માટે આપ Investor@dutronindia.com or ahmedabad@linkintime.co.in પર સંપર્ક કરી શકો છો.

ડયુટ્રોન પોલિમર્સ લિમિટેડ વતી

૩પા શાહ

કંપની સેક્રેટરી

તા : 04-08-२०२४ સ્થળ : અમદાવાદ.

ता : ०५-०५-२०२४

સ્થળ : અમદાવાદ.

DUTRON POLYMERS LIMITED

REGISTERED OFFICE: DUTRON HOUSE, NR. MITHAKHALI UNDERBRIDGE, NAVRANGPURA

આથી સર્વે સભ્યોના જણાવવામાં આવે છે કે આપણી કંપની ડયુટ્રોન પોલિમર્સ લિમિટેડની ૪૩મી વાર્ષિક સામાન્યસભા

સેબી તથા કેન્દ્ર સરકારની સૂચના પ્રમાણે આ વાર્ષિક સભાનો અહેવાલ બધા સભ્યોને વિજાણુ માધ્યમ/ ઈમેલ દારા જ

મોકલવામાં આવેલ છે. જે સભ્યોના ઈમેલ કંપની કે તેના RTA પાસે નોંધાયેલ છે. તેમને જ આ અહેવાલ ઈમેલ થી મોકલવામાં આવેલ છે. આ અહેવાલ કંપનીની અધિકૃત વેબસાઈટ www.dutronindia.com શેરબજારની વેબસાઈટ www.bseindia.com પર ઉપલબ્ધ રહેશે. જે સભ્યોએ પોતાનું ઈમેલ સરનામું અને બેંક ખાતાની વીગત નથી આપેલ, તેમને વિનંતી છે તે તેઓ વહેલામાં વહેલી તકે

પોતાનું આ વિગતો નોંધાવી દે. (ક) જે સભ્યોના શેર ડિમેટ થયેલા નથી અને શેરનું પ્રમાણપત્ર કાગળ સ્વરૂપે છે, તે સભ્યો આ માટે કંપનીના RTA લિંક ઈન ટાઈમ ઈ. પ્રા. લિનો સંપર્ક કરે (ખ) જે સભ્યોના શેર ડિમેટ થયેલા છે. તેઓ પોતાના

જે સભ્યોને આ ટીડીએસ નથી લાગું પડતો તેઓ પોતાનું ૧૫જી કે ૧૫એચ પત્રક ૫ જુલાઈ ૨૦૨૪ની સાંજે ૫ વાગ્યા પહેલા મળે તે રીતે, કંપનીને મોકલી આપે. આ સમય બાદ મળેલ પત્રકને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

કરેલ છે. આ માટે વધુ વીગતો કંપની દ્વારા જે વાર્ષિકસભાની સુચના મોકલવામાં આવેલ છે. તેમાં આપેલ છે. આ સવલત ૯ જુલાઈ ૨૦૨૪ રોજ સવારે ૧૧ વાગ્યે પ્રારંભ થઈનેથી ૧૧ જુલાઈ ૨૦૨૪ના રોજ સાંજે ૫ વાગે બંધ થઈ જશે.

આવશે તો તેણે સીડીએસએલ જે મત આપ્યો હશે, તે જ આખરી ગણવામાં આવશે.

રૂપા શાહ કંપની સેકેટરી

કલ્યાણી શાળા અતુલમાં વિશ્વ પર્ચાવરણ દિવસની ઉજવણી



(प्रतिनिधि)वस्साड,

તારીખ ૫- ૬-૨૦૨૪ ના રોજ શાળામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વન વિભાગ, વલસાડ wwf ગુજરાત રાજ્યના, ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ, વાપી ના સંયુક્ત ઉપક્રમે અને કલ્યાણી જીએસપીસીએલના

જ્યા પટેલે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનું મહત્વ અને એની શરૂઆત ક્યારથી થઈ હતી તે વિશે વિગતે વાત કરી હતી. પ્રાર્થના બાદ શાળાના પટાંગણમાં ૩૦ જેટલા છોડોનું વાવેતર કરવામાં શાળાના યજમાન પદે કરવામાં આવી હતી. આ પ્રસંગે વન વિભાગના આરએફઓ હેતલબેન ભંડારી ડબલ્યુ ડબલ્યુ એફના મૌતિક દવે જીએસપીસીએલ વાપીના પરેશ પટેલ શ્રી અતુલ સ્વાતિ બેન લાલભાઈ, અતુલ ગ્રામના પ્રથમ નાગરિક સરપંચ વિક્રમભાઈ પટેલ પારનેરા ગામના સરપંચ ભરતભાઈ તથા ડેપ્યુટી સરપંચ હિતેશભાઈ સામાર્જિક અને શાળાના સમગ્ર સ્ટાફે સુંદર રીતે કર્યું હતું. આચાર્યએ તમામ શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રોને અગ્રણી પ્રવીણભાઈ wwf અને અન્ય અધિકારીઓ વન વિભાગના રજાના દિવસે હાજર રહીવૃક્ષ રોપણ કરવા બદલ અભિનંદન પાઠવીને કર્મચારીઓ તથા શાળાના દરેક વ્યક્તિ એ એક વૃક્ષ વાવવાની વિદ્યાર્થીઓ ધોરણ ૧૨ ના વિદ્યાર્થી મિત્રો અને સમગ્ર સ્ટાફ ઉપસ્થિત હાકલ કરી હતી. જેથી પક્ષીઓનો રહ્યો હતો. આચાર્ય સુનિલ પટેલે મીઠો કલરવ ,શીતળ છાંયડો અને વાતાવરણમાં ઠંડક ઉત્પન્ન થઈ શકે. સૌપ્રથમ મહેમાનોને આવકાર્યા

આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીને પર્યાવરણ વિષયક કીવીઝ રમાડવામાં આવી હતી અને સાચો જવાબ આપનારને ઇનામો આપવામાં આવ્યા હતા. આભાર કેળવણી મંડળના આદરણીય ટ્સ્ટી વિધિ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર સંજયભાઈ પટેલે કરી હતી સમગ્ર કાયક્રમનું સુપરે આયોજન ઇકો ક્લબના કન્વિનર નીતિનભાઈ તથા જગદીશભાઈ

હતા. અને જણાવ્યું કે ૨૦૧૩ થી

આ વૃક્ષ ઉછેરનો યજ્ઞ અવિરતપણે

મંગાભાઈ વહેરા ઉ.વ.૪૫ રહે. ત્રાજપર ખારી હોવાનું જાણવા મળ્યું છે કે જોકે પ્રૌઢનું મોત કયા કારણોસર થયું છે. સ્પષ્ટ થયું નથી. પોલીસે મૃતદેહ પીએમ અર્થો હોસ્પીટલ ખસેડાયો છે. મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બનાવની નોધ કરીર વધુ તપાસ

મોરબીમાં મળેલા મૃતદેહની ઓળખ થઈ મોરબીઃ મોરબીના ન્યુ

કોલેજના તમામ શિક્ષકો અને

પ્રોફેસરો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય

મહેમાન ફતેહસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ

અનંતરાવ નિકમ, જોઈન્ટ સેક્રેટરી

જયેન્દ્રસિંહ રાઠોડ અને કારોબારીના

સભ્યો અને શિક્ષકોએ વૃક્ષારોપણ કરી

વૃક્ષારોપણને પ્રોત્સાહન આપ્યું હતું જેથી આજના વધતા જતા પ્રદુષણ અને

ઊંચા તાપમાનને ઘટાડી શકાય. આ

કાર્યક્રમ અંતર્ગત શાળાના સ્કાઉટ અને

ગાઈડ અને એન.સી.સી. વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ

લીધો હતો અને વૃક્ષારોપણમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ત્યાર બાદ મુખ્ય

મહેમાન દ્વારા માનવ જીવન માટે વૃક્ષો અત્યંત આવશ્યક છે તેવો સંદેશ

આપ્યો હતો. પર્યાવરણની જાળવણી

અને સમાજ કલ્યાણ માટે વૃક્ષારોપણ

એ દરેક વ્યક્તિની નૈતિક ફરજ છે.

પેલેસના ગેટ પાસે એલઈ કોલેજ રોડ પરથી પ્રૌઢનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મૃતક ખેગારભાઈ ચલાવી છે.

પશ્ચિમ રેલવે – અમદાવાદ ડિવિઝન

| <u>વિવિધ એન્જિનીયરીંગ કામ</u> ઈ-ટેન્ડર નોટીસ નં. 08, વર્ષ 2024-2025. તા. 31-05-2024 | | | | | | | | |
|--|---|--|---------------------------|-------------------|--|--|--|--|
| ઇ-ટન્ ક્રમ નં. | ઈ-ટેન્ડર નં. | કામનું નામ | NITની અંદાજીત પડતર (₹) | ઈએમડી પડતર (₹) | | | | |
| 01 | ડીઆરએમ-એડીઆઈ- 70-2024-25 | ડિવિઝનલ એન્જિનિયર (વર્કસ) અમદાવાદના અધિકારક્ષેત્ર હેઠળ વિવિધ | 7,81,47,152.00 | 5,40,700.00 | | | | |
| સ્થળ | સ્થળોએ RCC ઓવરહેડ ટેન્ક્સનું બાંધકામ કરવાનું અને અન્ય આનુષંગિક કામ કરવાનું કામ. | | | | | | | |
| 02 | ડીઆરએમ-એડીઆઈ- 71-2024-25 | અમદાવાદ ડિવિઝનના અધિકારક્ષેત્રમાં વિવિધ સ્થળોએ ઓટોમેશન વાલ્વ્સની | 1,58,06,601.80 | 2,29,000.00 | | | | |
| જોગ | જોગવાઈ કરવાનું, લગાવવાનું અને સંસ્થાપન કરવાનું તેમજ અન્ય આનુષંગિક કામ કરવાનું કામ. | | | | | | | |
| 03 | | અમદાવાદ ડિવિઝન : દેખરેખ, નિરિક્ષણ અને પેટ્રોલીંગ પ્રવૃત્તિઓ માટે (ચાર વર્ષના) | | 1,97,900.00 | | | | |
| AM | AMC સહિત G.P.S. આધારિત (એન્ડ્રોઈડ બેઝ) મોબાઈલ સર્વેલન્સ ટેકિંગ સિસ્ટમની જોગવાઈ કરવાનું કામ. | | | | | | | |
| 04 | ડીઆરએમ-એડીઆઈ- 73-2024-25 | અમદાવાદ-ગેરતપુર અને અમદાવાદ- ચાંદલોડીયા-ખોડીયાર-મહેસાણાઃ | 7,93,25,303.92 | 5,46,600.00 | | | | |
| 3.5 TBF 202 DEI વિસ્ત | PQRS દ્વારા 12.604 કિ.મી. 60 Kg. CTR (P) (અમદાવાદ-વિરમગામ અને અમદાવાદ-ખોડીયાર), 3.504 કિ.મી. 60 Kg. TRR (P) (અમદાવાદ-વિરમગામ અને અમદાવાદ-ખોડીયાર) અને 17.20 કિ.મી. TBR (ગેરતપુર-અમદાવાદ), LC નં. 1/EPH ના ઓવરહ્યોલીંગ સહિત રેલવે સીમામાં ટોરન્ટ બાજુમાં પો. નં. 202/C નું TTR, ચાંદલોડીયા-ખોડીયાર સેક્શનના ક્રિ. નં. 21 અને 22A નું 60 Kg. TRR(P) અને સિનિ. DEN (દક્ષિણ) અમદાવાદના અધિકારક્ષેત્ર હેઠળ (સાબરમતી BG અને સાબરમતી જે.) લાઈન નં. 1 નાડેડ એન્ડનું વિસ્તરણ કરવા દ્વારા પાર્સલ લોડિંગ લાઈનની જોગવાઈ અને અવિરત વ્યવહારની સુવિધા માટે દક્ષિણ રિસેપ્શન અને ઉચ્ચેગ પ્રાપ્ત મહાગાન એક્સોપ્યોર કહ્યુ અને સ્માપ્ત હતા. | | | | | | | |

ડીઆરએમ-એડીઆઈ-74-2024-25 અમદાવાદ ડિવિઝનઃ લાઈડર સર્વે ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્ટેશન યાર્ડસ 2,34,27,758.72 2,67,100.00

| ı | અને | અને સેક્શન્સનું ગ્રેડિયેન્ટ વેરિફિકેશન કરવાનું કામ. | | | | | | |
|----------------------------------|--|---|---|--|-------------|--|--|--|
| | 06 | | સિનિ. ડિવિઝનલ એન્જિનિયર (દક્ષિણ) અમદાવાદના અધિકારક્ષેત્રમાં RUB ની | | 1,64,500.00 | | | |
| ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણાનું કામ. | | | | | | | | |
| | 07 | | ડિ વિઝનલ એન્જિનિયર (NW) અમદાવાદના અધિકારક્ષેત્ર હેઠળ હુક બોલ્ટ | | 1,90,200.00 | | | |
| 1 | માટે બ્રિંગલ પીએ ઓીંગ ઈન્સ્ટેંડ રીયજેલલ M-27 લોક નર અને ફિંગ પ્લેટ બોલ્ટ્સ માટે M-25 લોક નરની જો | | | | | | | |

કરવાનું અને લગાવવાનું કામ ડિવિઝનલ એન્જિનીયર (સંકલન)-અમદાવાદ, DRM એફીસ, ચામુંડા બ્રિજ પાસે, ન્યુ સ્વદેશી મોલ સામે, નરોડા રોડ અમદુપુરા, અમદાવાદ-382345.**ઈ-ટેન્ડરમાં ભાગ લેવા માટેવેબસાઈટ: <u>www.ireps.gov.in</u> _{ADI-0દ}** અમને લાશક કરો: **f** facebook.com/WesternRly∙ અમને ફોલો કરો: **∑** twitter.com/WesternRly



અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ

"ટ્રાન્સપોર્ટ હાઉસ", જમાલપુર દરવાજા બહાર, બહેરામપુરા, અમદાવાદ-૩૮૦૦૨૨. ફોન. નં.૦७૯ ૨૫૩૯૧૮૮૧થી ૮૬



શોર્ટ ટેન્ડર નોટીસ

શોર્ટ ટેન્ડર નં.૧/૨૪X૨પઃ અ.મ્યુ.ટ્રા.સર્વિસના જમાલપુર ખાતે ઓફીસ બિલ્ડીંગના ઝાંપા નં.૧, મેઈન વર્કશોપ ઝાંપા નં.૨, મિલ્લતનગર ડેપોમાં તથા

ટેન્ડર https://tender.nprocure.com ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. ટેન્ડર ડાઉનલોડ/અપલોડ કરવાની છેલ્લી તા.૧૫/૦૬/૨૦૨૪, સમય

તા.૦૬/૦૬/૨૦૨૪,

અ.મ્યુ.ટ્રા.સ.સંબંધિત સુચન/ફરીયાદ માટે ડાયલ કરો ટોલ ફ્રી નં. ૧૮૦૦૨૩૩૦૮૮૧ વોટ્સએપ ૭૦૬૯૦૧૫૭૩૫

વેસ્ટર્ન ટાઇમ્સમાં પ્રકાશિત

CI424 SISP41

જાહેરાતો અંગે વાંચકોએ પોતાની રીતે ચકાસણી કરી નિર્ણય લેવો.

ચાલું જ છે. શાળાની વિદ્યાર્થીની

જીયા નાયકા, જીનલ શિંદે અને

-જાહેરખબર મેનેજર

<u>ટેલિકોમ સુવિધાઓ પૂરી પાડવી</u> સિગ્નલ એન્ડ ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ ટેન્ડર નં.: DRM-SnT-ADI-Tele 07 o 2024-25;કાર્યનું નામ: અમદાવાદ ડિવિઝનન ગાંધીધામ, માલિયા મિયાણા, ન્યુ ભુજ (NBV) અને અન્ય સ્થળોએ ટેલિકોમ સુવિધાઓ પૂરી પાડવી; **કામનો અંદાજિત ખર્ય:** 6179746.54/- (રુપિયા એકસઠ લાખ, ઓગણ

પશ્ચિમ રેલવે-અમદાવાદ ડિવિઝન

એંશી હજાર, સાતસો છેતાલીસ અને યોપન પૈસા પુરા); બિડ સિક્યોરીટી: ₹ 123600/- (એક લાખ ત્રેવીસ હજાર છસો પુરા); **ટેન્ડર બંધ થશે અને ટેન્ડર ખોલાશે:** 01/07/2024 ના રોજ 15.00 કલાકે; બંધ થશે અને 01/07/2024 ન રોજ 15.30 કલાકે ખોલાશે. **ઇ-ટેન્ડરિંગની** વેબસાઇટ- www.ireps.gov.in

अभने साग्र≲ हरोः f facebook.com/WesternRly પશ્ચિમ રેલવે–અમદ્યવાદ ડિવિઝન

લેવલ ક્રોસિંગને નાબૂદ કરવા અને

<u>ટેલિકોમ સુવિધાઓનો વિકાસ કરવો</u> टेन्डर आमंत्रण नोटिस नं. - DRM-SnT ADI-Tele 08 of 24-25: ભારતના રાષ્ટ્રપતિ નાટે અને તેમના વતી કાર્યકારી DRM/S એન્ડ ' ટેન્ડર નંબર DRM-SnT-ADI-Tele 08 of 24 25 સામે ઇ-ટેન્ડરો આમંત્રિત કરે છે છેલ્લં **તારીખ 01.07.2024, 15:00** બિડર્સ તેમન મૂળ / સંશોધિત બિડ ફ્રેક્ત છેલ્લી તારીખ અને સમય સુધી જ જમા કરાવી શકશે, આ ટેન્ડર સામે મેન્યુઅલ ઑફર્સની મંજૂરી નથી, અને આવી પ્રાપ્ત મચુંબલ સાંફ્રતમાં મન્દ્રદાગવા, અને આવા પ્રાત થયોલ કોઈપણ મેન્યુઅલ ઑફરને ધ્યાનમાં લેવામાં આવશે નહીં; (1) કામનું નામ: અમદાવાદ ડિવિઝનના રાધનપુર, સામખિયાળી અને વિવિધ સ્થળોએ વેવલ ફ્રોસિંગને નાબ્દ્ર કરવા અને ટેલિકોમ સુવિધાઓનો વિકાસ કરવો

(2) કામની અંદાજિત ખર્ચ: ₹ 66,96,574.42/ (રુ. છાસઠ લાખ છન્નુ હજાર પાંચસો યુુમોતેર અને હિંગ કે તેના પુત્ર કુ કાર્યા વધા યુનાલ અને સ્વ બેતાલીસ પૈસા પુરા); (3) અનેસ્ટ મની ડિપોઝિટ: ₹ 1,33,900/- (રુ. એક લાખ તેત્રીસ હજાર નવસો પુરા); (4) બંધ થવાની તારીખ અને સમય: 01,07.2024 ના 15:00 કલાકથી મોડા નહીં; **(5) ટેન્ડર ખોલવાની તારીખ અને સમય:** 01.07.2024 ના રોજ 15:30 કલાકે ખુલશે; **(6) ઇ-ટેન્ડરીંગની વેબ સાઇટ**:

अभने सा85 हरोः f facebook.com/WesternRly

AHMEDABAD-380009. CIN NO. L25209GJ1981PLC004786 WEBSITE: dutronindia.com Email Id: investor@dutronindia.com

૪૩મી વાર્ષિક સામાન્યસભા માટે સૂચના

શુક્રવાર તારીખ ૧૨ જૂલાઈ ૨૦૨૪ના રોજ સવારે ૧૧.૩૦ વાગ્યે વિજાણુ/ધ્વનિ માધ્યમો દ્વારા યોજાશે. આ સામાન્યસભામાં જે મુદ્દાઓ પર વિચારણા કરવામાં આવનાર છે, તે સભ્યોને મોકલી આપવામાં આવેલ છે.

જો વાર્ષિક સામાન્ય સભા ડિવિડંડ ચૂકવવાં માટે મંજૂરી આપે તો કંપની દ્વારા આ ડિવિડંડ ઉપર ટીડીએસ કાપવામાં આવશે.

કંપની દ્વારા તેના સભ્યોને દૂરથી મતદાન કરવાની સવલત આપવામાં આવે છે. આ માટે કંપનીએ સીડીએસએલ સાથે કરાર

વાર્ષિકસભા દરમિયાન પણ કંપની દ્વારા દૂરથી મતદાન કરવાની સવલત આપવામાં આવશે. જે સભ્યોએ સીડીએસએલના મતદાનમાં મત આપેલ નથી, તેવાં જ સભ્યો આ સવલતનો લાભ લઈ શકશે. જો કોઈ સભ્યો દ્વારા બન્ને સ્થાને મત આપવામાં

આ વિશે વધુ માહિતી મેળવવા માટે આપ સંપર્ક કરો. Investor@dutronindia.com અથવા ahmedabad@linkintime.co.in

ડચુટ્રોન પોલિમર્સ વતી

સહી/- દિમી ખંડેલવાલ (કંપની સેક્રેટરી) મેમ્બરશીપ નં. એક્૧૧૩૪૦

તારીખ : ૦૫મી જૂન, ૨૦૨૪

https://www.hdbfs.com/investors પર ઉપલબ્ધ છે.

શ્રીનાથ ડેપોમાં પરકોલેટીંગ વેલ બનાવવાના કામ બાબત.

૧૮.૦૦ સુધી. અ.મ્યુ.ટ્રા.સ.દ્વારા પ્રકાશિત